



જૈનદર્શાન અને અસ્પૃશ્યતા

— શ્રી કપૂરચંદ રણછોડાસ વારેયા

જૈનદર્શાન મુખ્યત્વે કર્મવાદને માનનાર દર્શાન છે. વિશ્વતાંત્ર કર્મજન્ય વિચિત્રતાને આધારે ચાલી રહ્યું છે. કર્મના મુખ્ય આડ લેહા છે. તેમાં એક ગોત્ર કર્મ છે. ગોત્ર કર્મના મુખ્ય એ લેહા છે : (૧) ઉચ્ચ ગોત્ર, (૨) નીચ ગોત્ર. નીચ કુળમાં જન્મ થવો એ પણ કર્મજન્ય છે. ઉચ્ચ કુળની પ્રાપ્તિ થવી પુષ્ટોદ્યને આલારી છે. નીચ કુળમાં જન્મ થવો એ પાપોદ્યને આલારી છે. પુષ્ટોદ્યથી પ્રાપ્ત સામન્દીનો મહ કરવો ન જોઈએ પોતાનાથી હીન સામન્દીવાળા ઉપર અસ્યુયા ન લાવવી જોઈએ એમ શાનીપુરુષો ડગે-પગલે કહી રહ્યા છે, પણ સાથે સાથે દરેકે પોતાની મર્યાદામાં રહીને કાર્ય કરવું જોઈએ, એ પણ નક્કર વ્યવસ્થા છે.

આજે કેટલાક ભાઈઓ અજ્ઞાનતાના કારણે કહે છે કે, 'જૈન શાસ્ત્રથોમાં વર્ણાદ્ય-વસ્થા કે સ્પૃશ્યત્વ નથી.' પણ તેઓની સમજ ભૂલભરેલી છે. આગમથંથો, પ્રકરણો, ચુર્ણિઓ અને ટીકા અંથોમાં સ્પૃશ્યાસ્પૃશ્યત્વ અંગેના અનેક ઉલ્લેખો જેવા મળે છે. જૈનેતર અંથોમાં પણ સ્પૃશ્યાસ્પૃશ્યત્વ તેમ જ મંદિરપ્રવેશનિષેધ અંગે ધાર્ણાં પ્રમાણે મળે છે. આ વિષયના જ્ઞાતા પૂજય પુરુષો પાસેથી કેટલાંક પ્રમાણે મેળવી જિજાસુ વર્ગની જાણ આતર અહીં આપવામાં આવ્યાં છે.

જૈન અંથોમાં આપવામાં આવેલાં પ્રમાણો :

મૂળ ચાર વર્ણો અને પછીથી તેના સાંકર્યથી (અરસપરસના સમાગમથી) અનેક જ્ઞાતિઓ જન્મની છે. ('આવશ્યક નિર્યુક્તિ' અધ્યયન ૧, ઉદ્દેશો ૧.)

(વર્ણાદ્યવરસા અને જ્ઞાતિને જેઓ માનવાને તૈયાર નથી, તેમને માટે આ પાડ બોધિય છે.)

અરિહંત, ચક્રવર્તી, ખળદેવ, વાસુદેવ વગેરે ઉત્તમ પુરુષો ચંડાલ આદિ હુક્કા કુળમાં જન્મ લેતા નથી. ('કદમ્પસૂત્ર' મૂળ પૃષ્ઠ ૨૨)

(ઉચ્ચ-નીચની વ્યવસ્થા આજની નથી પણ સનાતન છે, એ આ ઉપરના વાક્યથી સાખીત થાય છે.)

સાધુ વગેરે પૂજય પુરુષોની અવહેલના કરવાથી નીચ ગોત્ર અંધાય છે અને માતાંગ વગેરે હુક્કા કુળમાં તે લોગવાય છે. (ઉત્તરાધ્યયન ચિત્ત-સંભૂતિ અધ્યયન)

(કયા કારણે હુક્કા કુળમાં ઉત્પત્ત થવું પડે છે, એ પણ સૂત્રપાડ જણાવે છે.)

*** શ્રી આર્ય કદમ્પાણ ગૌતમ સમૃતિ ગ્રંથ ***

સ્પર્શયોસ્પર્શ્ય વ્યવહાર જળવવામાં ન આવે તો વ્યવહાર ફૂલિત થાય છે. વ્યવહારમાં સ્પર્શયોસ્પર્શ્યની વ્યવસ્થા માન્ય છે. ('આવશ્યક સૂત્ર.' [મલયગિરિ કૃત ટીકા] પૃષ્ઠ ૨૭)

હેવદર્શન કરનારાઓની ને નિંદા કરે છે, તે ચંડાળ વગેરે જલિઓમાં જન્મ લઈ ને છેવટે નરકમાં જાય છે. ('શત્રુંજય માહાત્મ્ય')

નીચ કુળના માણુસોને દીક્ષા આપવી, તેના આહારાદિ વેવા, તેના મકાનમાં વસવું વગેરે જેનદર્શનમાં નિષિદ્ધ છે. ('ઓદનિર્યુક્તિ.' પૃષ્ઠ ૧૫૭, ગાથા ૪૪૨)

કુંભ, માતંગ, ચંડાળ, ડેડ વગેરે હુમેશના સૂતકી છે, માટે તેની સાથે વ્યવહાર કરવો ન કર્યો. ('વિચાર રત્નાકર' પૃષ્ઠ ૧૫૬)

મતુષ્યો એ પ્રકારના છે : આર્ય અને મ્લેચ્છ. તેમાં પણ જલિથી આર્ય અને જલિથી મ્લેચ્છ, એમ એ લેદ છે. યવન, ભીલ, ચંડાળ આદિ જલિથી મ્લેચ્છ છે.

(‘તત્ત્વાર્થ’ સૂત્ર.’ હારિલદ્રીય ટીકા પૃ. ૩, સૂત્ર-૧૫, પૃષ્ઠ ૧૮૦)

અશુદ્ધ આચારવાળા માણુસો સાથે શ્રાવકોએ સંસર્ગ ન રાખવો, સહાચારી સાથે સંસર્ગ અને સંખાંધ રાખવો. ('ધર્મભિંહુ' અધ્યયન ૪)

વિશીષિત જલિ-કુળમાં જન્મેલાને જ દીક્ષા આપી શકાય. જેની સાથે વિવાહ કરી શકાય, તેવા ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા દીક્ષાના અધિકારી છે. ('ધર્મભિંહુ' અધ્યયન ૪) દ્શાવૈકાલિક સૂત્રમાં નિષિદ્ધ કુળમાં ગોચરી માટે જવાનો સાધુઓને નિષેધ કરેલ છે. નિષિદ્ધ કુળ એ પ્રકારનું છે : એક ભર્યાદિત કાળના અને બીજા હુમેશના અર્થાત સહા કાળના. તેમાં પ્રથમમાં જયાં વ્યવહાર ચાલુ હોય, છતાં પ્રસૂતિ, મરણું ધર્ત્યાદિ કરણે સૂતકાલાળા હોય તે. બીજામાં-સહા કાળ જેની સાથે વ્યવહાર ન હોય એવા ડેડ, ચંડાળ, કુંભ, ચયાર ધર્ત્યાદિ.

(‘દ્શાવૈકાલિક ચૂંણિ.’ પૃષ્ઠ ૧૭૪)

જેની સાથે વ્યવહાર ન હોય, તેવા કુળમાં સાધુ ગોચરી માટે ન જાય.

(‘દ્શાવૈકાલિક.’ [હારિલદ્રીય ટીકા] પૃષ્ઠ ૧૬૬)

જુંગિત એટલે નિહિત કુણો જિંદગી વર્ણન છે. તેની સાથે કેદી પણ જલનો વ્યવહાર રાખી શકાય નહિ. ('નિશીથ સૂત્ર.' ઉદ્દેશો ૪, ગાથા ૧૬૧૦)

જે સાધુ જુંગિત એટલે હુલકા કુળમાંથી આહાર વગેરે કે, તેને પ્રાયશ્ક્રિત આવે છે.

(‘નિશીથ સૂત્ર.’ ઉદ્દેશો ૧૬)

જે સાધુ નીચ કુળના માણુસો પાસેથી વખ્ત વગેરે બ્રહ્મણ કરે, તો તેને પણ પ્રાયશ્ક્રિત લાગે છે.

(‘નિશીથ સૂત્ર.’ ગાથા ૧૬૨૮)

નીચ કુળના મકાનમાં રહીને પઠન-પાઠ કરે, ધાર્મિક અનુષ્ઠાનો કરે કે વસે, તેને તીર્થી-કરની આજાનો લંગ કર્યાનું પાપ લાગે.

(‘નિશીથ સૂત્ર.’ ગાથા ૬૩૭)



શ્રી આર્ય કષ્યાળ ગોતમ સ્મૃતિ ગ્રંથ

જાની હોય, છતાં પણ જે તે સહાયારી ન હોય, તો સેવા કરવા ચોણ્ય નથી; જેમ ડંડા પાણીવાળો હોય, પણ ચંડાલનો ઝૂવો હોય, તો તેનો કુલીન માણુસો આશ્રય કરતા નથી. (‘દ્રશ્ય વૈકાલિક.’ હારિલદ્રીય ટીકા)

શાસનની અપભાજના, નિંદા અને અવહેલના કરનાર આત્મા અનેક ભવો સુધી સારી સ્થિતિમાંથી હુંર રાખનાર હુલકી જ્ઞતિમાં જન્મ પામે છે.

(શ્રી હરિલદ્રસ્તુરિ કૃત ‘અષ્ટક્મં અષ્ટક’)

વડુડ, છીયા, ચમાર, ડેડ, દુંબ વગેરે જ્ઞતિના લોકો સહાકાળ માટેના સૂતકી છે. તેમની સાથે સંખાંધ રાખવાથી હુર્ગુણો વધે છે, માટે સંખાંધ ન રાખવો.

(‘વ્યવહાર લાષ્યવૃત્તિ.’ ઉદ્દેશો ૧)

સમાન કુળ અને સમાન આચારવાળો હોય, પણ જ્ઞતિ વિરુદ્ધ કાર્ય કરતો હોય, તેની સાથે વિવાહ સંખાંધ રાખવો નહિ. (‘ધર્મણિંહુ.’ અ૦ ૧, સૂત્ર ૧૨)

‘હે રાજન! માનવોમાં શ્વપાક-ચંડાળ જ્ઞતિ અધમ છે. જ્યાં અમે જન્મયા હતા અને સર્વ જન્મની અવહેલના સહુન કરતા હતા. પાપક્રમ નિરત એવી શ્વપાક જ્ઞતિમાં ચિરકાળ રહ્યા અને પૂર્વકૃત કર્મના ઉદ્ઘે લોકમાં હુગાંધા અને જુગુપ્સાને પામ્યા.’

(‘ઉત્તરાધ્યયન.’ અ૦ ૧૩, ગાથા ૧૮-૧૯)

એક વખત સાત હજાર માતંગ, ડેડ અને પાંચસો ઉઝ્જડ એક ડેઢના સંધમાં શ્રી શાનુંજ્ય તીર્થની યાત્રાએ આવ્યા હતા, પરંતુ ગીતાર્થીના કહેવાથી તીર્થની આશાતના ન થાય માટે શ્રી શાનુંજ્ય તીર્થને પ્રદક્ષિણા દઈને જ તેણીમાંથી પાછા વળ્યા હતા.

(રથમંહિરગણિ કૃત ‘ઉપહેશ તરંગિણી.’ પૃષ્ઠ ૨૫૦)

કર્મવશ આત્માએ ઊંચ-નીચ જ્ઞતિને પામે છે. (‘પ્રશમસ્તિ.’ શ્લોક ૮૧)

કિલિષિક દેવો અથુલ કર્મના ઉદ્ઘવાળા હોય છે, તેઓને ચંડાળ જેવા ગણુબામાં આવે છે. (‘અભુત્સંઅહણી ટીકા.’ પૃષ્ઠ ૫)

મેતાર્ય ચંડાળ હતા, એટલે જ શ્રેણિક રાજાએ પોતાની કન્યા પરણુવવાની ના પાડી હતી. લોકોમાં હીલના પામ્યા હતા, દેવની સહાય હતી, તેથી ક્ષીર સમુદ્રના પાણીથી તેમના શરીરને શુદ્ધ કરવામાં આવ્યું. સામાન્ય જનેથી ન થઈ શકે, તેવાં અનેક કાર્યો દેવસહાયથી તેમણે કરી ખતાવ્યાં. અહુલુત માણુસ જાણી જનતાએ તેમને વ્યવહારમાં લીધા. મેતાર્યને જનસમૂહ સાથેનો વ્યવહાર તેમની જ્ઞતિના કારણે થયો ન હતો, પણ અદ્ભુતતાના કારણે થયો હતો. (‘ભરતેશ્વર-ખાહુખલીવૃત્તિ’)

કુતરો, ગધેડો, ચંડાલ, મદનો ઘડો, રજસ્વલા સ્વી, મહદું અને ચામડું એટલાંને અહકી જવાય તો વસ્તુ સહિત સ્નાન કરવું. (‘કુમારપાત ચરિત્ર’)

શ્રી આર્ય ઉત્ત્યાહુગોતમ સ્મૃતિ ગંધુ

यांडाल अने यवन वर्गेरे भेदेच्छना घरमां जे सोजन करे तो ५० उपवास, ५० एकासण्या, पांच तीर्थयात्रा, पांच साधर्मिक वात्सल्य, पांच जिनपूजा शांतिस्नान सहित करवी, तथा संधसक्ति वर्गेरेनुं प्रायश्चित्त पूर्ण थया आह मारी, जल अने औषधि भिन्न करीने तेनाथी सनान करवुँ. तेनाथी ते शुद्ध थाय. जे ए प्रभाषे न करे तो शांति अहार करवो अने तेने पोतानी साथे ऐसाडवो पण नहि. ए ज प्रभाषे लील, मोर्ची वर्गेरेने त्यां लोजन करे, तो पण जुहा जुहा प्रायश्चित्तो कराववा. यांडालनी खी साथे समागम करे, तो तेनी साथे व्यवहार त्याग करवो.

(‘अहौन्नीति-प्रायश्चित्त अधिकार’ श्लोक २ थी ४२)

सपृश्यास्पृश्यत्व इक्त मनुष्येमां ज छे एम नथी, देवेमां पण छे; केम कै, किलिपिक हेवो अस्पृश्यपण्याथी जिनेश्वर देवेना जन्म महेत्सव, अष्टाहिंका महेत्सव आहिमां लाग लाई शक्ता नथी, ते अंगे ‘लोकप्रकाश’ अंथमां आ सुज्ञ छे :

अमी च चाण्डालप्राया निन्द्यकर्माधिकारिणः ।

अस्पृश्यत्वादन्यदेवै – धिकृतास्तर्जनादिभिः ॥ ८६ ॥

देवलोके विमानेषु स्वधामुक्पर्षदादिषु ।

कौतुकादिसंगतेषु देवानां निकरेषु च ॥ ८७ ॥

अष्टाहिंकाद्युत्सवेषु जिनजन्मोत्सवादिषु ।

अप्राप्नुवन्तः स्थानं ते स्वं शोचन्ति विषादिनः ॥ ८८ ॥

(‘लोकप्रकाश’ मुद्रित प्रत. पृष्ठ ३५४-३५५)

लावार्य : ए यांडाल सरभा निंद्य किया करनारा किलिपिक हेवो अन्य देवो वडे तर्जना वर्गेरेथी खिळार पामेला अस्पृश्यपण्याथी देवलोकमां, विमानेमां देवेनी पर्षदामां कौतुक वर्गेरेथी लेगा थपेला देवेना समूहमां अष्टाहिंका आहि उत्सवमां अने जिनेश्वरेना जन्म महेत्सव आहिमां स्थानने नहि पाभता ऐह पामेला पोतानी निंद्या करे छे.

अहीं कोऽधिकने एवो प्रश्न थाय कै, ‘किलिपिक हेवो जन्मथी मरणु पर्यंत अशुद्ध आहार करनारा होता नथी, कारण कै देवलोकमां कौणियाथी आवारप उत्ताहार कौर्झ हेवेने होतो नथी, हेवो मनोभक्ती होय छे, ते पुढगवो पण अत्यंत स्वच्छ होय छे, तेमनुं शरीर पण सुंदर होय छे, वर्तन पण अहींना यांडेनी लेम नीच होतु नथी, तो शा कारण्याथी अस्पृश्यपण्युं प्राप्त थयुं ?

तेनो उत्तरमां प. श्री विनयविजयल महाराजे श्री भगवती सूत्रना आधारे लघ्युं छे : ‘पूर्व भवमां आचार्य – उपाध्याय वर्गेरेनो अपयश करनारा थया. भिथ्याभिनिवेशथी पोताना आत्माने तथा भीजना आत्माने प्रभु मार्गीथी विपरीत मार्गमां नोडनारा थया, ते भिथ्याभिनिवेशी ज्वो घण्णां वर्षा सुधी चारित्रपर्याय पाणी मरणु पर्यंत



ॐ आर्य कष्यापु गोतम समृति ग्रन्थ ॥

તે પાપની આડોચના કર્યા વિના ડિવિષિક દેવોમાં ઉત્પન્ન થયા, એટલે પૂર્વ ભવમાં પૂર્વે કહેલ અધોર પાપ બાંધ્યું, તે કારણે દેવગતિમાં પણ તે હેવો અસ્પૃશ્ય જનવાથી દેવ સલા, નાટક સલા, સંગીત સલા, શ્રી જિનેશ્વર ભગવંતના જનમ મહોત્સવ આદિમાં પ્રવેશ કરી શકતા નથી.

જ્યારે ડિવિષિક દેવો દેવલખમાં જનમથી મરણ પર્યાત કોઈ પણ અશુદ્ધ કિયા, અશુદ્ધ લક્ષણ આદિ કરતા નથી, છતાં પૂર્વ ભવમાં કરેલ દેવ - શુરુ નિંદા આદિના લીધે નીચ ગોત્રકર્મ બાંધી ચંડાલ જાતિમાં ઉત્પન્ન થયેલ લુંબો પવિત્રતમ શ્રી જિનમંહિરમાં પ્રવેશ ન પામે તે યુક્તિસંગત છે.

શાસ્ત્રવના અજણ એવા કેટલાક કહે છે કે, ‘ભગવંત નિરંજન નિરાકાર હોવાથી તેમને આસદછેટ લાગતી નથી.’ તો તે મહાતુભાવોએ જાણવું જોઈએ કે, અનુભન્દાકા પ્રાણપ્રતિષ્ઠા કરતી વખતે જિનપ્રતિમામાં શાસનરક્ષક દેવાધિષ્ઠિત કરતી વખતે જિનપ્રતિમામાં તત્ત્વસત્તા સ્થાપન કરેલી હોય, તે ઢેડ-ચંડાલ આદિના પ્રવેશ થવાથી નાટ થઈ જાય, અને તેમ થવાથી લક્ષતપુરુષોની લક્ષિતવિશેષનો વ્યાધાત થઈ જાય તેમ ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી વાચક પણ ‘નયનામૃત તરંગિણી’ અંથમાં લખે છે.

આ રીતે ભગવતી સૂત્ર ઉત્તરાધ્યન સૂત્ર, આવશ્યક ટીકા, નિશીથ સૂત્ર, દર્શાવૈકાલિક સૂત્ર, વ્યવહાર સૂત્ર, ઓધ નિર્યુક્તિ, અણક પ્રકરણ, તત્ત્વાર્થ સૂત્ર, ધર્મણિંદુ, અહોનીતિ, પ્રવચન સારોદ્ધાર આદિ અનેક અંગ્રેઝમાં સ્પૃશ્યાસ્પૃશ્યત્વ તથા હરિજન આદિ સાથેની વ્યવહારમર્યાદા અંગેના ઉલ્લેખો મળે છે.

વાસ્તવમાં સ્પૃશ્યાસ્પૃશ્યત્વ એ વૈજ્ઞાનિક છે. તેમાં તુચ્છ મનોવૃત્તિ નથી. પ્રણકીય શુદ્ધિ વારસાગત ચાલુ રહે તે માટેની સામાજિક વ્યવસ્થા છે. માતા કે ખ્રી રજ્જવલા થાય ત્યારે મુત્ર કે પતિ સ્પર્શ કરતાં નથી, તેમાં તેઓ પ્રત્યેની તુચ્છ વૃત્તિ નથી, પણ શુદ્ધિનું ધોરણું સાચવવાનું છે. ડેક્ટર ફરીને તપાસ્યા પણી ડેટ્લીક વખત હાથ સાયુથી ધોઈ સાર્ક કરે છે, તેનું કારણ પણ એક જાતની અસ્પૃશ્યતા હોય તે જાતની શુદ્ધિ કરવી ધરે. લોહીગત અસ્પૃશ્યતા દ્વારા કરવામાં ધણો સમય લાગે.

વાચક વર્ગ સ્પૃશ્યાસ્પૃશ્યત્વને વિજ્ઞાનસિદ્ધ સામાજિક વ્યવસ્થા સમજ કોઈ પણ જાતના પૂર્વથી વિના માનવમાત્ર અત્યે વાસ્તવિક સમભાવ રાખી મહાપુરુષોએ આત્માના વિકાસ માટે વ્યવસ્થાનું પાતન કરી આધ્યાત્મિક ઉન્નતિ સાધે, એ જ અંતરની અભિલાષા !

x

x

x

* * * શ્રી આર્ય કષ્યાણા ગોતમ સ્મૃતિ ગ્રંથ * * *